



Vipul V. Patel

B.Com. LL.B.

Advocate (Gujarat High Court)

Offi.: -301- Raviraj Complex-1, Second Floor,

Opp. Balaji Hall, 150 Ft. Ring Road,

Mavdi Plot, Rajkot. - 360004 (Gujarat).

Mobile No. 98795 22296

Email :- vvpateladv@gmail.com

બાબત :- જનરલ ટાઈટલ વેરીફિકેશન રીપોર્ટ

અરજદાર:- "શ્રી રાજ ડેવલોપર્સ" ના નામથી ચાલતી ભાગીદારી પેઢી.

આથી ઉપરોક્ત અરજદારએ મારી સમક્ષ રજુ કરેલ નીચે જણાવેલ મિલ્કતના ઉતરોતર દસ્તાવેજોની અસલ ફાઈલ જોઈ તપાસતા તેનું વિગતવાર વર્ણન નીચે મુજબ મળેલ છે. જેનું ઈન્સપેક્શન સબ-રજીસ્ટ્રાર કચેરીમાં કરતા અમોને નીચે મુજબની વિગતો મળેલ છે જેનો આથી જનરલ ટાઈટલ વેરીફિકેટ રીપોર્ટ આપવામાં આવે છે.

-: મિલ્કતનું વર્ણન :-

ગુજરાત રાજ્યના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ રાજકોટ શહેરના મ્યુનિ. કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવેલ ગામ વાવડીના રેવન્યુ સર્વે નં. ૬૪ પૈકી ૧ જેના ટી.પી. સ્કીમ નં. ૧૫ (વાવડી), ઓ.પી નં. ૧૮, એફ.પી. નં. ૧૮/૧ ની જમીન ચો.મી. ૬૦૮૫-૦૦ (બિનખેતી થતા સર્વે નં. ૬૪ પૈકી ૧ પૈકી ૨/પૈકી ૧) ના બિનખેડવાણ અને ઈમારત બાંધવાની તેમજ રહેણાંકના હેતુ માટેની મંજૂરીવાળા જે "સત્યમ પાર્ક" તરીકે ઓળખાતા જમીનના પ્લોટસ પૈકી સીંગલ યુનિટ-૧ ની જમીન ચો.મી. ૨૦૫૫-૦૮ તથા કોમન પ્લોટની જમીન ચો.મી. ૨૨૮-૩૮ (જેમાં કોમન પ્લોટનો એરીયા ચો.મી. ૨૨૮-૩૮ ના વપરાશી તથા સુખાધિકારના સંપૂર્ણ હકકો સહિત) એમ મળી કુલ જમીન ચો.મી. ૨૨૮૩-૪૬ ઉપર બાંધવામાં આવેલ "રંગમહોલ" ના નામથી ઓળખાતા કોર્મશીયલ કમ રહેણાંક હેતુ માટેના હાઈ-રાઈઝ બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરેલ છે. જેના ઉતરોતરના ટાઈટલ ડીડ્ઝ નીચે મુજબ છે.



- ઉતરે ::- લાગુ એફ.પી. નં. ૫૨/એ તથા પ્લોટ નં. ૩૮ ની જમીન, તે તરફ માપ મીટર ૩૭-૬૦ તથા ૧૩-૫૦ છે.
- દક્ષિણે ::- ૧૫-૦૦ મીટરનો જાહેર રસ્તો, તે તરફ ગોળાઈ સહિત માપ મીટર ૨૮-૮૭૫ તથા ૨૧-૨૨૫ છે.
- પુર્વે ::- ૨૪-૦૦ મીટરનો જાહેર રસ્તો, તે તરફ ગોળાઈ સહિત માપ મીટર ૫૭-૨૦ છે.
- પશ્ચિમે ::- પ્લોટ નં. ૩૦ થી ૩૮ ની જમીન તથા ૭-૫૦ મીટરનો જાહેર રસ્તો, તે તરફ માપ મીટર ૪૬-૪૪ તથા ૧૦-૭૬ છે.

//૨//

વાવડી ગામની જંગલ બુક મુજબ રેવન્યુ સર્વે નં. ૬૪ ની જમીન એકર ૫-૧૫ ગુંઠા આવેલ છે. શ્રી ધીરુભા વાઘુભા તથા શ્રી નીરુભા જીલુભા તથા શ્રી લખુભા જીલુભાના નામે ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૬ થી કબજા હકક પ્રમાણિત મળતા નોંધ પ્રમાણિત થયેલ છે. બાદ શ્રી ધીરુભા વાઘુભા વિગેરે તથા શ્રી લખુભા જીલુભા સંયુક્ત ખાતેદાર હોય જે માંહેથી શ્રી લખુભા જીલુભાનું અવસાન થતા શ્રી બહાદુરસંગ લખુભા વિગેરેના નામે વારસાઈ નોંધ નં. ૧૦૮ થી પ્રમાણિત થયેલ છે. ત્યારબાદ શ્રી ધીરુભાઈ વાઘુભા વિગેરેની જમીનની નવી માપણીના આંકડા સર્વે ખાતેથી તૈયાર થઈ આવતા ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૧૪૮ થી પ્રમાણિત થયેલ છે. ત્યારબાદ શ્રી ધીરુભા વાઘુભા તથા શ્રી નીરુભા લખુભા તથા શ્રી બહાદુરસંગ, શ્રી અનુભા, શ્રી વિમળાબા લખુભા તથા સગીર યોગરાજ લખુભા તથા સગીર કુસુમબા લખુભાના વાલી તરીકે શ્રી નીરુભા જીલુભાની જમીનની નવી માપણીના આંકડા સર્વે ખાતેથી તૈયાર થઈ આવતા ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૨૦૬ થી પ્રમાણિત થયેલ છે. બાદ શ્રી ધીરુભા વાઘુભા તથા શ્રી નીરુભા લખુભા વિગેરે વચ્ચે ઘરમેળે ભાયુભાગની વહેંચણી કરતા ભાયુભાગે શ્રી ધીરુભા વાઘુભાના ખાતે સર્વે નં. ૬૪ ની જમીન એકર ૫-૧૫ ગુંઠા આવેલ છે. જેની ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૬૪૩ થી પ્રમાણિત થયેલ છે. ત્યારબાદ શ્રી ધીરુભા વાઘુભા નું અવસાન થતા ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૬૫૮ થી શ્રી મોહનસિંહ ધીરુભા તથા શ્રી ટેમુભા ધીરુભા તથા શ્રી વિજયાબા ધીરુભા તથા શ્રી દેવુભા ધીરુભા તથા શ્રી સનુભા ધીરુભા તથા શ્રી જસુભા ધીરુભા તથા શ્રી રતનબા ધીરુભાના નામે વારસાઈ નોંધ પ્રમાણિત થયેલ છે. બાદ શ્રી મોહનસિંહ ધીરુભાનું અવસાન થતા ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૬૬૮ થી શ્રી કૃષ્ણબા મોહનસિંહ તથા શ્રી અશ્વિનકુમાર મોહનસિંહ તથા શ્રી કુંદનબા મોહનસિંહ તથા શ્રી રંજનબા મોહનસિંહ તથા શ્રી મયુરકુમાર મોહનસિંહ સગીરના વાલી શ્રી કૃષ્ણબા મોહનસિંહના નામે વારસાઈ નોંધ પ્રમાણિત થયેલ છે. બાદ શ્રી કૃષ્ણબા મોહનસિંહનું અવસાન થતા ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૬૮૮ થી શ્રી અશ્વિનકુમાર મોહનસિંહ તથા શ્રી મયુરસિંહ મોહનસિંહ તથા શ્રી કુંદનબા મોહનસિંહ તથા શ્રી રંજનબા મોહનસિંહ સગીરના વાલી શ્રી ટેમુભા ધીરુભા તથા શ્રી નીરુભા જીલુભાના નામે વારસાઈ નોંધ પ્રમાણિત થયેલ છે. ત્યારબાદ શ્રી ટેમુભા ધીરુભા વિગેરે વચ્ચે ઘરમેળે ભાયુભાગની વહેંચણી કરતા શ્રી ટેમુભા ધીરુભા તથા શ્રી અરવિંદસિંહ ટેમુભા તથા શ્રી જયરાજસિંહ ટેમુભાના ખાતે સર્વે નં. ૬૪ ની જમીન એકર ૨-૨૮ ગુંઠા આવેલ છે. જેની ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૧૬૮૬ થી પ્રમાણિત થયેલ છે. બાદ સદરહું જમીન શ્રી ટેમુભા ધીરુભા વિગેરેએ શ્રી મનજીભાઈ રાજાભાઈ પરસાણા જોગ રજી. વેચાણ દસ્તાવેજ અનુ. નં. ૮૬૪ તા. ૨૫/૦૨/૨૦૦૪ થી વેચાણ આપતા ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૨૫૦૬ થી વેચાણ દસ્તાવેજ મુજબની નોંધ પ્રમાણિત થયેલ છે. બાદ શ્રી મનજીભાઈ રાજાભાઈ પરસાણાએ શ્રી સુરેશભાઈ કરમશીભાઈ ભટ્ટી વિગેરે-૪ જોગ રજી. વેચાણ દસ્તાવેજ ૧ નંબરની બુકના નં. ૧૩૧૬ તા. ૧૭/૦૨/૨૦૦૫ થી વેચાણ આપતા ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૨૭૮૦ થી વેચાણ દસ્તાવેજ મુજબની નોંધ પ્રમાણિત થયેલ છે. બાદ સદરહું જમીન શ્રી સુરેશભાઈ કરમશીભાઈ ભટ્ટી વિગેરે-૪ એ શ્રી છગનભાઈ મોહનભાઈ કાકડીયા વિગેરે-૧૦ જોગ રજી. વેચાણ દસ્તાવેજ અનુ. નં. ૧૪૫૪૭ તા. ૦૩/૦૮/૨૦૧૧ થી વેચાણ આપતા ગામ નમુના નં. ૬ ના નોંધ નં. ૬૭૫૫ થી વેચાણ દસ્તાવેજ મુજબની નોંધ પ્રમાણિત થયેલ છે.



//૩//

સદરહું જમીનમાં ટી.પી. સ્કીમ નં. ૧૫ (વાવડી) અમલમાં આવતા ઓ.પી. નં. ૧૮, એફ.પી. નં. ૧૮/૧ થી જમીન ચો.મી. ૬૦૮૫-૦૦ ફાળવણી થતા અને સદરહું જમીન રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવવા માટે કલેક્ટર કચેરી, રાજકોટમાં ઓનલાઈન અરજી કરતા રાજકોટના મહે. કલેક્ટર સાહેબશ્રીએ તેમના બિનખેતીના હુકમ નં. ૭૨/૦૮/૦૬/૦૫૬/૨૦૨૦ તા. ૩૦/૦૧/૨૦૨૦ ના રોજના બિનખેતી (બહુહેતુક ઉપયોગ) હુકમથી બિનખેડવાણ કરી આપેલ છે. બાદ સદરહું જમીન રહેણાંકના હેતુ માટે બિનખેતી લે-આઉટ પ્લાન માટે ટાઉન પ્લાનીંગ શાખા, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં અરજી કરતા જમીન આંકવા/ભાગ કરવાની અરજીની મંજૂરી વર્ગીકરણ નં. ૪ તા. ૧૮/૦૬/૨૦૨૦ થી બિનખેતી લે-આઉટ પ્લાન મંજૂર કરાવેલ છે. જેમાં પ્લોટ નં. ૧ થી ૩૮ ની જમીન ચો.મી. ૨૫૮૮-૩૦૬ તથા પ્લોટ નં. ૧ થી ૩૮ માટેના કોમન પ્લોટનો એરીયા ચો.મી. ૩૮૦-૧૬૦ તથા સીગલ યુનિટ-૧ ની જમીન ચો.મી. ૨૦૫૫-૦૮૦ તથા સીગલ યુનિટ-૧ માટેના કોમન પ્લોટનો એરીયા ચો.મી. ૨૨૮-૩૮૦ તથા ઈન્ટરનલ રોડનો એરીયા ચો.મી. ૮૩૨-૦૭૪ મળી કુલ જમીન ચો.મી. ૬૦૮૫-૦૦ છે. જેને તેઓએ "સત્યમ પાર્ક" તરીકે ઓળખાવેલ છે. જેની ગામ નમુના નં. ૮-અ ના ખાતા નં. ૩૨૬, ગામ નમુના નં. ૬ (હકકપત્રક) ના નોંધ નં. ૮૮૯૧ થી બિનખેતી હુકમ મુજબની નોંધ પ્રમાણીત થયેલ છે તથા ગામ નમુના નં. ૨ ના અનુ. નં. ૨૮૮૬ થી નોંધ દાખલ થયેલ છે. ત્યારબાદ સદરહું બિનખેડવાણ થયેલ જમીનમાં શ્રી જગદીશભાઈ જાદવભાઈ પરસાણા વિગેરે-૪ એ તેમના અવિભાજ્ય ૩૭.૫૦ % ના હિસ્સાની જમીન શ્રી રાજેન્દ્રકુમાર ગોવિંદભાઈ ભંડેરી વિગેરે-૩ જોગ રજી. વેચાણ દસ્તાવેજ અનુ. નં. ૨૮૩૮ તા. ૦૭/૦૮/૨૦૨૦ થી વેચાણ આપતા ગામ નમુના નં. ૨ ના અનુ. નં. ૨૮૦૩ થી દાખલ થયેલ છે. બાદ સદરહું જમીનનું શ્રી રાજેન્દ્રકુમાર ગોવિંદભાઈ ભંડેરી વિગેરેએ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ હાજર રહી શકીએ તેમ ન હોય, નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ-૩૩ ની જોગવાઈ મુજબ તેઓના અવિભાજ્ય હિસ્સાની જમીનના દસ્તાવેજો સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી માટે રજુ કરવા, સહીઓ કરવા, કબુલાત આપવા માટે શ્રી છગનભાઈ મોહનભાઈ કાકડીયા જોગ રજી. અનુ. નં. ૨૮૪૦ તા. ૦૭/૦૮/૨૦૨૦ થી કુલમુખત્યાર તરીકે નિમણુંક કરેલ છે. બાદ રેવન્યુ સર્વે નં. ૬૪ પૈકી ૧ જેના ટી.પી. સ્કીમ નં. ૧૫ (વાવડી), ઓ.પી. નં. ૧૮, એફ.પી. નં. ૧૮/૧ ની જમીન ચો.મી. ૬૦૮૫-૦૦ (બિનખેતી થતા સર્વે નં. ૬૪ પૈકી ૧ પૈકી ૨/પૈકી ૧) ના બિનખેડવાણ અને ઈમારત બાંધવાની તેમજ રહેણાંકના હેતુ માટેની મંજૂરીવાળા જે "સત્યમ પાર્ક" તરીકે ઓળખાતા જમીનના પ્લોટસ પૈકી સીગલ યુનિટ-૧ ની જમીન ચો.મી. ૨૦૫૫-૦૮ તથા કોમન પ્લોટની જમીન ચો.મી. ૨૨૮-૩૮ (જેમાં કોમન પ્લોટનો એરીયા ચો.મી. ૨૨૮-૩૮ ના વપરાશી તથા સુખાધિકારના સંપૂર્ણ હકકો સહિત) એમ મળી કુલ જમીન ચો.મી. ૨૨૮૩-૪૬ ની ખુલ્લી જમીન શ્રી છગનભાઈ મોહનભાઈ કાકડીયા વિગેરેએ "શ્રી રાજ ડેવલોપર્સ" ના નામથી ચાલતી ભાગીદારી પેઢી જોગ રજી. વેચાણ દસ્તાવેજ અનુ. નં. ૪૧૮૩ તા. ૦૫/૦૮/૨૦૨૧ થી વેચાણ આપતા તેની ગામ નમુના નં. ૨ ના અનુ. નં. ૬૪૩૩ થી વેચાણ દસ્તાવેજ મુજબની નોંધ દાખલ થયેલ છે. સદરહું "શ્રી રાજ



//૪//

ડેવલોપર્સ" ના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે રજી.અનુ.નં. ૫૪૨૯ તા. ૧૮/૦૬/૨૦૨૧ થી ભાગીદારી દસ્તાવેજ થયેલ છે. સદરહું જમીન ઉપર બાંધકામ માટે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાંથી બાંધકામ પરવાનગી નં. ૧૧૪ તા. ૦૭/૦૭/૨૦૨૨ થી કોર્મશીયલ કમ રહેણાંક હેતુ માટેના હાઈ-રાઈઝ બિલ્ડીંગના બાંધકામ માટેનો બિલ્ડીંગ લે-આઉટ પ્લાન પાસ કરાવેલ છે. જેમાં બેઝમેન્ટમાં ક્વર્ડ પાર્કીંગ, ૨-સીડી, ૨-લીફ્ટ, ૨-ફાયર લીફ્ટ, પેસેજ તથા રેમ્પ તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં ૧૩-દુકાનો, ૭-ડબલ્યુ.સી., ૪-યુરીનલ, ૨-ટોયલેટ, હેન્ડીકેપ ટોયલેટ, મીટર રૂમ, વિઝીટર પાર્કીંગ, પાર્કીંગ, ૪-સીડી, ૨-લીફ્ટ, ૨-ફાયર લીફ્ટ, તથા પેસેજ તથા ફર્સ્ટ ફ્લોર થી ટેન્થ ફ્લોરમાં કુલ-૭૦ ફ્લેટસનું બાંધકામ કરેલ છે. જેનું "રંગમહોલ" નામકરણ કરેલ છે.

સદરહું મિલ્કત અંગે પક્ષકારોએ મારી સમક્ષ રજુ કરેલ ફાઈનલ ઉતરોતર અસલ ફાઈલ જોતા તેના પર કોઈ ગીરો, બોજો જણાતો નથી, તે ટાઈટલ કલીયર, માર્કેટેબલ અને ફ્લોલેસ છે. તેમજ સદરહું હાલના માલિકીક "શ્રી રાજ ડેવલોપર્સ" ના નામથી ચાલતી ભાગીદારી પેઢીના નામે મિલ્કતના માલિકીક હકકના ટાઈટલની ઉતરોતર સાંકળ મળતી આવે છે. તેના આધારે આ મિલ્કત માર્કેટેબલ અને ટાઈટલ કલીયર છે તે અંગેનો આ જનરલ ટાઈટલ વેરીફિકેશન રીપોર્ટ આપવામાં આવે છે.


આથી સદરહું મિલ્કતના ઉપર મુજબના તમામ ડોક્યુમેન્ટ મેં વાચેલ છે તેમજ ચકાસેલ છે તેમજ તા. ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ સને ૧૯૯૧ થી ૧૯૯૯ એટલે કે ૯-વર્ષના સર્ચની પહોંચ જેના પહોંચ નં. ૨૦૨૨૦૨૨૦૦૦૨૦૩૬૦ થી રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ માં તેમજ તા. ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ સને ૧૯૯૯ થી ૨૦૧૨ એટલે કે ૧૩ વર્ષના સર્ચની પહોંચ જેના પહોંચ નં. ૨૦૨૨૦૨૩૦૦૦૨૬૪૫૧ થી રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરી ઝોન-૨ તેમજ તા. ૦૪/૦૮/૨૦૧૯ ના રોજ સને ૨૦૧૨ થી ૨૦૨૨ એટલે કે ૧૧-વર્ષના સર્ચની પહોંચ જેના પહોંચ નં. ૨૦૨૨૩૨૭૦૦૦૦૮૫૭૧ થી રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરી ઝોન-૭ માં એમ કુલ-૩૨ વર્ષની સર્ચ કરેલ છે. તેના આધારે આ મિલ્કત માર્કેટેબલ અને ટાઈટલ કલીયર છે તે અંગેનો આ જનરલ ટાઈટલ વેરીફિકેશન રીપોર્ટ આપવામાં આવે છે.



સ્થળ:- રાજકોટ.

તા. ૦૫/૦૮/૨૦૨૨





વિપુલ વી. પટેલ
એડવોકેટ

સનદ નં. G/1291/2005

અરજી પહોંચ

મિલકત નું વર્ણન : વાવડી.રે.સ.ન.64 પૈકી 1/પૈકી 2/પૈકી 1 સિંગલ.યુ.ન.1 તથા કોમન પ્લોટ.ન.2283.46

Search in : RAJKOT-1/RAJKOT-1

પહોંચ નંબર 202202200020360 અરજી નંબર 14513 અરજી વર્ષ 2022
તારીખ 2 માહે ઓગસ્ટ સને 2022

રજુ કરનારનું નામ વિપુલ.વી.પટેલ.(એડ).શોધ
નીચે પ્રમાણે ફી પહોંચી

રૂ. પૈસા

રજીસ્ટ્રેશન ફી.....

નકલ કરવા ની ફી સાઈડ / ફોલીયો.....

શેરોની નકલ કરવા માટે ફી.....

ટપાલ ખર્ચ.....

નકલો અથવા યાદીઓ (કલમ 54 થી 59).....

શોધ અગર તપાસણી.....Year: 1991 1999

દંડ કલમ-૨૫.....

કલમ-૩૪ (કલમ-૫૭).....

નકલ ફી ફોલીયો.....

ઈન્ડેક્સ-૨ ફી



100.00

કુલ એકંદરે રૂ.

100.00

અંકે રૂપિયા એક સો શૂન્ય પુરા

દસ્તાવેજ

ના દિવસે તૈયાર થશે અને

તે રજીસ્ટર ટપાલથી મોકલવામાં

આવશે.

નકલ

કચેરીમાં આપવામાં

દસ્તાવેજ રજીસ્ટર ટપાલથી નીચેના સરનામે મોકલશો.



P K Shukla
સબ રજીસ્ટ્રાર
રાજકોટ - 1

અંકે રૂ. : 100.00

20220801756430361

સબ રજીસ્ટ્રાર, રાજકોટ - 1

અરજી પહોંચ

મિલકત નું વર્ણન : રે.સ.ન:64 પૈકી 1 પૈકી 2/પૈકી 1 સીંગલ યુનિટ-1 તથા કોમન પ્લોટ ચો.મી.2283.46

Search in : વાવડી /VAVDI

પહોંચ નંબર ૨૦૨૨૦૨૩૦૦૦૨૬૪૫૧

અરજી નંબર

૧૫૩૧૩

અરજી વર્ષ

૨૦૨૨

તારીખ ૨

માહે

ઓગસ્ટ

સને

૨૦૨૨

રજુ કરનારનું નામ વી.વી.પટેલ (એડ) શોધ

નીચે પ્રમાણે ફી પહોંચી

રૂ. પૈસા

રજીસ્ટ્રેશન ફી.....

નકલ કરવા ની ફી સાઈડ / ફોલીયો.....

શેરોની નકલ કરવા માટે ફી.....

ટપાલ ખર્ચ.....

નકલો અથવા યાદીઓ (કલમ ૬૪ થી ૬૭).....

શોધ અગર તપાસણી.....Year: 1998 2012

૧૭૦.૦૦

દંડ કલમ-૨૫.....

કલમ-૩૪ (કલમ-૫૭).....

નકલ ફી ફોલીયો.....

ઈન્ડેક્સ-૨ ફી

કુલ એકંદરે રૂ.

૧૭૦.૦૦

અંકે રૂપીયા એક સો સીત્તેર પુરા

દસ્તાવેજ

ના દિવસે તૈયાર થશે અને

તે રજીસ્ટર ટપાલથી મોકલવામાં

આવશે.

નકલ

કચેરીમાં આપવામાં

દસ્તાવેજ રજીસ્ટર ટપાલથી નીચેના સરનામે મોકલશો.



A. M. Dasani
સબ રજીસ્ટ્રાર
રાજકોટ - 2

અંકે રૂ. : 170.00

20220801855647947

સબ રજીસ્ટ્રાર, રાજકોટ - 2

અરજી પહોંચ

મિલકત નું વર્ણન : વાવડી ના રે.સ.નં. 64 પૈકી 1 પૈકી 2/પૈકી 1, સીંગલ યુનિટ 1 તથા કોમન પ્લોટ

Search in : Vavdi/Vavdi

પહોંચ નંબર 202232700008571 અરજી નંબર 3247 અરજી વર્ષ 2022
તારીખ 4 માહે ઓગસ્ટ સને 2022

રજુ કરનારનું નામ વિપુલ વી.પટેલ (એડવોકેટ) (શોધ)

નીચે પ્રમાણે ફી પહોંચી

રૂ. પૈસા

રજીસ્ટ્રેશન ફી.....

નકલ કરવા ની ફી સાઈડ / ફોલીયો.....

શેરોની નકલ કરવા માટે ફી.....

ટપાલ ખર્ચ.....

નકલો અથવા યાદીઓ (કલમ 54 થી 59).....

શોધ અગર તપાસણી.....Year: 2012 2022

દંડ કલમ-૨૫.....

કલમ-૩૪ (કલમ-૫૭).....

નકલ ફી ફોલીયો.....

ઈન્ડેક્સ-૨ ફી



120.00

કુલ એકદરે રૂ.

120.00

અંકે રૂપીયા એક સો વીસ પુરા

દસ્તાવેજ

ના દિવસે તૈયાર થશે અને

તે રજીસ્ટર ટપાલથી મોકલવામાં

આવશે.

નકલ

કચેરીમાં આપવામાં

દસ્તાવેજ રજીસ્ટર ટપાલથી નીચેના સરનામે મોકલશો.

VINKAL SURESHBHAI KAGATHRA
સબ રજીસ્ટ્રાર
રાજકોટ - 7 - કોઠારીયા



અંકે રૂ. : 120.00

20220802123790126

સબ રજીસ્ટ્રાર, રાજકોટ - 7 - કોઠારીયા